

የሰውን ደም የሚያፈስስ ሁሉ ደሙ ይፈስሳል፤ ሰውን በእግዚአብሔር መልክ ፈጥሮታል።

8	ጠቅላይ							
	ጠቅላይ							
	ጠቅላይ							

እናንተም ብዙ፣ ተባዙ፤ በምድር ላይ ተቀላቋ። እርቡባትም።

8	ጠቅላይ							
	ጠቅላይ							
	ጠቅላይ							

እግዚአብሔርም ለኖሳና ለልጆቹ እንዲህ ብሎ ተናገረ።

9	ጠቅላይ							
	ጠቅላይ							
	ጠቅላይ							

እኔም እነሆ ቃል ኪዳንን ከእናንተና በኋላ ከሚመጣው ከዘራችሁ ጋር አቆማለሁ፤

10	ጠቅላይ								
	ጠቅላይ								
	ጠቅላይ								

ከእናንተ ጋር ላሉትም ሕያው ነፍስ ላላቸው ሁሉ፣ ከእናንተ ጋር ከመርከብ ለወጡት ለወፎቶ፣ ለእንስሳትም ለምድር አራዊትም ሁሉ፣ ለማንኛውም ለምድር አራዊት ሁሉ ይሆናል።

11	ጠቅላይ								
	ጠቅላይ								
	ጠቅላይ								

ቃል ኪዳንንም ለእናንተ አቆማለሁ፤ ሥጋ ያለውም ሁሉ ዳግመኛ በጥፋት ውኃ አይጠፋም፤ ምድርንም ለማጥፋት ዳግመኛ የጥፋት ውኃ አይሆንም።

12	ጠቅላይ								
	ጠቅላይ								
	ጠቅላይ								

እግዚአብሔርም አለ። በእኔና በእናንተ መካከል፣ ከእናንተም ጋር ባለው በሕያው ነፍስ ሁሉ መካከል፣ ለዘላለም የማደርገው የቃል ኪዳን ምልክት ይህ ነው፤

13	ጠቅላይ								
	ጠቅላይ								
	ጠቅላይ								

ቀስቴን በደመና አድርጌአለሁ፤ የቃል ኪዳንም ምልክት በእኔና በምድር መካከል ይሆናል።

14	ጠቅላይ							
	ጠቅላይ							
	ጠቅላይ							

በምድር ላይ ደመናን በጋረድሁ ጊዜ ቀስቴቱ በደመናው ትታያለች፤

15
 וְזָכַרְתִּי אֶת-בְּרִיתִי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H5315 H3605 H0996 H0996 H0996 H1285 H0853 H2142

תִּזְכְּרוּ אֶת-בְּרִיתִי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H1320 H3605 H7843 H3999 H4325 H5750 H1961 H3808 H1320 H3605

በእኔና በእናንተ መካከል፡ ሕያው ነፍስ ባለውም ሥጋ ሁሉ መካከል ያለውን ቃል ኪዳን አስባለሁ፤ ሥጋ ያለውንም ሁሉ ያጠፋ ዘንድ ዳግመኛ የጥፋት ውን አይሆንም።

16
 וְהִיטֵתָּ הַקְּשֶׁת בְּעֵינַי וְרֵאִיתִיָּהּ לְזִכְרֹךָ בְּרִיתִי עוֹלָם
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0430 H0996 H5769 H1285 H2142 H7200 H6051 H7198 H1961

וְהִיטֵתָּ הַקְּשֶׁת בְּעֵינַי וְרֵאִיתִיָּהּ לְזִכְרֹךָ בְּרִיתִי עוֹלָם
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0776 H1320 H3605 H5315 H3605 H0996

ቀስተቱም በደመና ትሆናለች፤ በእኔና በምድር ላይ በሚኖር ሥጋ ባለው በሕያው ነፍስ ሁሉ መካከል ያለውን የዘላለም ቃል ኪዳን ለማሰብ አያታለሁ።

17
 וַיֹּאמֶר אֱלֹהִים אֶל-וַיֹּאמֶר אֱלֹהִים אֶל-וַיֹּאמֶר אֱלֹהִים
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0996 H0996 H5769 H1285 H2142 H7200 H6051 H7198 H1961

וַיֹּאמֶר אֱלֹהִים אֶל-וַיֹּאמֶר אֱלֹהִים
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0776 H1320 H3605 H5315 H3605 H0996

እግዚአብሔርም ኖሳን። በእኔና በምድር ላይ በሚኖር ሥጋ ባለው ሁሉ መካከል ያቆምሁት የቃል ኪዳን ምልክት ይህ ነው አለው።

18
 וַיִּהְיֶה אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H1931 H2526 H3315 H2526 H8035 H8392 H3318 H5146 H1961

אֲבִי כְנַעַן
 አባት
 H0001

ከመርከብ የወጡት የኖሳ ልጆችም እነዚህ ናቸው፡ ሴም፣ ካም፣ ያፌት፤ ካምም የከነዓን አባት ነው።

19
 וְשֵׁלֶשָׁה אֲבֹתָיו אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0776 H3605 H0428 H5146 H0428 H7969

የኖሳ ልጆች እነዚህ ሦስቱ ናቸው፤ ከእነርሱም ምድር ሁሉ ተሞላች።

20
 וַיִּקַּח אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H3754 H5193 H0127 H0376 H5146

ኖሳም ገበሬ መሆን ጀመረ፡ ወይንም ተከለ።

21
 וַיִּשְׁתַּחֲוֶה אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H0168 H8432 H1540 H7937 H3196 H8354

ከወይን ጠጃም ጠጣና ሰከረ፤ በድንኳኑም ውስጥ ዕራቁቱን ሆነ።

22
 וַיִּרְא אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 -לְאִלֹּהֵי אֱלֹהֵי אֲשֶׁר בֵּינִי וּבֵינְיֹכָם וּבֵין כָּל-נַפְשׁ יִזְכְּרוּ
 H2351 H0251 H8147 H5046 H0001 H6172 H0853 H0001 H2526 H7200

የከነዓን አባት ካምም የአባቱን ዕራቁትነት አየ፡ ወደ ውጭም ወጥቶ ለሁለቱ ወንድሞቹ ገራቸው።

תַּיְתָּא	וַיֵּלֶכְוּ	שְׁנֵי	בָּנָיו	עִלְיָו	וַיִּשְׁמְעוּ	הַשְּׂמֵרָה	אֶת	תְּפִלָּתוֹ	שָׁמַע	וַיִּקְרָא	23
ወደ-ኋላ	-እና-ሄሉ	ሁለቱ	ትከታፍ	-በ-ላይ	-እና-አዮሩ	-ያ-ልብስ	(?)	-እና-ያፊት	ሴም	-እና-ወሰሉ	
H0322	H3212	H8147	H7926			H8071	H0853	H3315	H8035	H3947	
אֶת	וַיִּקְרָא	אֶת	וַיִּקְרָא								
አዩ	አይ	አባታቸውን	-እና-ዕራቀት	ወደ-ኋላ	-እና-ፊታቸው	አባታቸውን	ዕራቀት	(?)	-እና-ሰቀሉ		
H7200	H3808	H0001	H6172	H0322	H6440	H0001	H6172	H0853	H3680		

ሴምና ያፌትም ሸማ ወስደው በጫንቃቸው ላይ አደረጉ፡ የኋለትም ሄደው የአባታቸውን ዕራቁትነት አለበሱ፤ ፊታቸውም ወደ ኋላ ነበረ፡ የአባታቸውንም ዕራቁትነት አላዩም።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	24	
-ያ-ትንስ	ልጁ	-ለ-እሱ	አደረገ	የ	(?)	-እና-አወቀ	-ከ-ወይዘ	ዮሐ	-እና-ነቃ	
					H0853	H3045	H3196	H5146	H3364	

ኖላም ከወይን ጠጁ ስከር ነቃ፡ ታናሹ ልጁ ያደረገበትንም አወቀ።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	25	
-ለ-ወንድሞቹ	ልጁ	-ለ-እሱ	አደረገ	የ	(?)	-እና-አወቀ	-ከ-ወይዘ	ዮሐ	-እና-ነቃ	
					H0251	H1961	H5650	H5650	H0779	H0559

አንዲህም አለ። ከነዓን ርጉም ይሁን፤ ለወንድሞቹም የባሪያዎች ባሪያ ይሁን።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	26
-ለ-እሱ	አገልጋይ	ከነዓን	-እና-ይሁን	ሴም	አምላክ	አገልጋይ	ዮሐ	-እና-አለ	
H3926	H5650		H1961	H8035	H0430	H3068	H1288	H0559	

አንዲህም አለ። የሴም አምላክ አገልጋዮች ይባራሩ፤ ከነዓንም ለእነርሱ ባሪያ ይሁን።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	27
-ለ-እሱ	አገልጋይ	ከነዓን	-እና-ይሁን	ሴም	አምላክ	አገልጋይ	ዮሐ	-እና-አለ	
H3926	H5650		H1961	H8035	H0168	H7931	H3315	H0430	

አገልጋዮችም ያፌትን ያስፋ፡ በሴምም ድንኳን ይደር፤ ከነዓንም ለእነርሱ ባሪያ ይሁን።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	28
ዓመት	-እና-አምሳ	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት
H8141	H2572	H8141	H3967	H7969	H3999		H5146	H2421	

ኖላም ከጥፋት ወኃ በኋላ ሦስት መቶ አምሳ ዓመት ኖረ።

וַיִּקְרָא	בְּנֵי	לְוָ	עֵשָׂו	אֶת	וַיִּקְרָא	מִיִּיגָ	נָ	וַיִּקְרָא	29
ዓመት	-እና-ሞተ	ዓመት	-እና-አምሳ	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት	ዓመት
H4191	H8141	H2572	H8141	H3967	H8672	H5146	H3117	H3605	H1961

ኖላም የኖረበት ዘመን ሁሉ ዘጠኝ መቶ አምሳ ዓመት ሆነ፤ ሞተም።